


જા.નં./RMSA/સર્જરી/૨૦૨૨/૩૨૯૭

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,
એ-૩, જિલ્લા સેવા સદન-૨,
અઠવાલાઈન્સ, સુરત.
તા. ૦૪/૦૩/૨૦૨૨

ઉક્ત પત્રની જાણ તથા અમલવારી કરવા સારું.


(એચ.એચ.સાજ્યગુરુ)
જિલ્લા શિક્ષણાધિકારી,
સુરત, જિ. સુરત.


પ્રતિ,
આચાર્યશ્રી,
સુરત શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ.મા.શાળાઓ તરફ,
જી.સુરત



જયશ્રી દેવાંગન, IAS

એડી. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર

સમગ્ર શિક્ષા, ગુજરાત



ગુજરાત શાળા શિક્ષણ પરિષદ

સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી,

સમગ્ર શિક્ષા, સેક્ટર-૧૭, ગાંધીનગર.

પીન-૩૮૨૦૧૭, ફોન.૦૭૯-૨૯૬૩૨૪૧૩

Email : - aspdssaguj@gmail.com

Toll Free No.1800-233-7965

ક્રમાંક: સમગ્ર શિક્ષા/એએસપીડી/૨૦૨૨/૭૫૮-૭૧૨૭

તા.૨૫.૦૨.૨૦૨૨

પ્રતિ,

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી / રાજ્ય શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર અને
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી
જિ. તમામ જિ. તમામ

વિષય : બાળકોના કપાયેલ હોઠ અને કપાયેલ તાળવા (Cleft lip and Cleft Palate and other facial deformities) ની વિનામૂલ્યે સર્જરી બાબત.

શ્રીમાન,

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ઈશા હોસ્પિટલ, અટલાન્ટિસની પાછળ, વડોદરા સેન્ટ્રલ, સારાભાઈ કેમ્પસ, વડોદરા દ્વારા "મિશન સ્માઈલ" હેઠળ બાળકોના કપાયેલ હોઠ અને કપાયેલ તાળવા (Cleft lip and Cleft Palate and other facial deformities) ની વિનામૂલ્યે સર્જરી કરવામાં આવે છે. આ માટે આ વર્ષે તા ૧૨ માર્ચ ૨૦૨૨ થી ૧૫ માર્ચ ૨૦૨૨ સુધી ઉપરોક્ત હોસ્પિટલ ખાતે બાળકોની વિનામૂલ્ય સર્જરી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તો આપના જિલ્લાના શાળાઓમાં ભણતા બાળક જેનું કપાયેલ હોઠ કે કપાયેલ તાળવાનું ઓપરેશન કરવાનું બાકી હોય કે પછી અગાઉ આ પ્રકારનું ઓપરેશન કર્યા બાદ પણ વધારે ક્રેક્ટીવ સર્જરીની જરૂરીયાત હોય તેવા બાળકોની યાદી શાળાના શિક્ષકો/મુખ્ય શિક્ષકો પાસેથી મેળવી જિલ્લા આઈ.ઈ.ડી. કો-ઓર્ડિનેટર દ્વારા આ હોસ્પિટલ ખાતે મોકલવા માટે તમામ બી.આર.સી./સી.આર.સી./સ્પે. એજ્યુકેટર્સ અને આઈ.ઈ.ડી.એસ.એસ.ના શિક્ષકોને આ બાબતથી અવગત કરી તેઓના માધ્યમથી જરૂરી વ્યવસ્થા ગોઠવવા અને તમામ જરૂરીયામંદ બાળકો અને વાલીઓને આ બાબતે જાણ થાય તે માટે સોશિયલ મિડિયા (વોટ્સએપ વિગેરે) મારફત પ્રસારીત કરવા પણ વિનંતી છે.

(સહી)

મિ.ગડન


25/2

(સહી)

પરિણામ કમિશનર

25/2

વધુ માહિતી માટે ઈશા હોસ્પિટલ ખાતે ડૉ. વરુણ રામચંદ્ર (મો.૯૭૩૭૦૭૮૭૭૦, ઇમેલ-
drvarun_r@yahoo.com)નો સંપર્ક કરવા વિનંતી છે.


(જયશ્રી દેવાંગન)

નકલ રવાના:

1. નાયબ નિયામકશ્રી, આર.એમ.એસ.એ., સમગ્ર શિક્ષા, સદર કચેરી
2. જિલ્લા આઈ.ઈ.ડી. કો-ઓર્ડિનેટર, તમામ... ઉપરોક્ત બાબતે તમામ આયોજન કરવા તેમજ તમામ સ્પે. એજ્યુકેટર અને આઈ.ઈ.ડી.એસ.એસ.ના શિક્ષકોને સાંકળવા સારું.

નકલ રવાના સવિનય જાણ સારું:

1. માન. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, સદર કચેરી



To
Smt. Jayshree Dewangan
A. S. P. D (I.A.S.)
S.S.
Grandhinarayan

Free Cleft Surgical Mission in Vadodara from March 12-15, 2022

Respected Sir/ Madam,

I take this opportunity to introduce Mission Smile (formerly known as Operation Smile India), the largest volunteer-based non-profit medical charity dedicated to provide free comprehensive life-changing reconstructive surgeries to children and young adults suffering from cleft lip, cleft palate and other facial deformities.

Mission Smile was founded in 2002 and since then we have achieved the following:

- 40,000 plus comprehensive cleft correction surgeries.
- 700 plus volunteers.
- 10 Outreach Centres pan India.
- 24X7 running Comprehensive Cleft Care Centre in Guwahati.
- 114 medical missions in India.

It gives immense pleasure to inform you about the Mission Smiles' fifth cleft care mission in Vadodara and over all tenth in Gujarat, is being conducted from March 12-15, 2022. The mission will be held at ISHA Hospital Vadodara, in partnership with Muthoot Pappachan Foundation.

Through this letter I would like to seek your support in all aspects to make the mission a successful one; especially in the process of patient identification, recruitment & creating awareness in the community about the mission!!

Highlights of the mission

- Free surgeries to all patients
- Free medicines & investigations
- Free Food & Accommodations for patients and guardians
- Free transportation (to and fro) for patients and guardians

Kolkata Office: Mission Smile, DPSC, Plot No. - X - 1, 2 & 3, Block EP, Sector 5, Salt Lake City, Kolkata - 700091

Registered Office: Mission Smile, S - 27, Panchsheel Park, New Delhi - 110 017. Visit us at: www.missionsmile.org



Dates of the mission

- 12 March 2022 (Screening and Patient Scheduling)
- 13-15 March 2022 (Surgery Days)
- 20 March 2022 (Follow Up)

Mission Smile believes that every cleft child deserves the right to smile and a chance to thrive instead of living in shame. Our free, life-changing surgeries take as little as 45 minutes and can give a boy or a girl a lifetime of smiles. However, since mere surgery is not the end, we provide free **Comprehensive cleft care**. This consists of cleft patient identification, medical evaluation, pre-operative care, post-operative care, surgery, medicines, speech therapy and dental care.

The team will have Plastic Surgeon, Maxillofacial Surgeon, Anaesthesiologists, Paediatricians, Dentist, Speech Language Pathologist, Child Psychologist, Nurses and other non-medical volunteers from across India.

Looking forward to your support to help us in patient recruitment for the mission and join hands in our common vision to make India a cleft free country...!

Sincerely,

DR. VARUN RAMACHANDRA
M.D.S.-ORAL & MAXILLOFACIAL SURGEON
CLEFT & CRANIOFACIAL SURGEON
FRCRCSI

Dr Varun Ramachandra
Maxilo Facial Surgeon
Project Director
Vadodara Comprehensive Cleft Care Centre
Isha Hospital, Vadodara, Gujarat